

## કલસિન: પત્રં

I ઈશ્વરસ્યેચ્છયા યીશુખ્રીષ્ટસ્ય પ્રેરિત: પौલસ્તીમથિયો ભાતા ચ કલસીનગરસ્થાન્ પવિત્રાન્ વિશ્વસ્તાન્ ખ્રીષ્ટાશ્રિતભાતૃન્ પ્રતિ પત્ર લિખતઃ।

II અસ્માંક તાત ઈશ્વર: પ્રભુ યીશુખ્રીષ્ટશ્રી યુષ્માન્ પ્રતિ પ્રસાંદ શાન્તિઅનુ ક્રિયાસ્તાં।

III ખ્રીષ્ટે યીશૌ યુષ્માંક વિશ્વાસસ્ય સર્વાન્ પવિત્રલોકાન્ પ્રતિ પ્રેમનશ્ચ વાર્તાં શ્રુત્વા।

IV વયં સદા યુષ્મદર્થ પ્રાર્થનાં કુર્વન્તાઃ સ્વર્ગો નિહિતાયા યુષ્માંક ભાવિસમ્પદ: કારણાત્ સ્વકીયપ્રભો યીશુખ્રીષ્ટસ્ય તાતમ્ ઈશ્વરં ધન્યં વદામઃ।

V યૂયં તસ્યા ભાવિસમ્પદો વાર્તાં યયા સુસંવાદરૂપિણ્યા સત્યવાણ્યા જાપિતાઃ।

VI સા યદૃત્કુસ્નં જગાદ અભિગાચ્છિતિ તદ્ગ્રદ્યુષ્માન્ અષ્ટલ્યગમત્, યૂયન્ન યદ્ દિનમ્ આરભ્યેશ્વરસ્યાનુગ્રહસ્ય વાર્તાં શ્રુત્વા સત્યરૂપેણ જાતવન્તસ્તદારભ્ય યુષ્માંક મધ્યેડપિ ફલતિ વર્જ્ઞતે ચ।

VII અસ્માંક પ્રિય: સહદાસો યુષ્માંક કૃતે ચ ખ્રીષ્ટસ્ય વિશ્વસ્તપરિચારકો ચ ઈપહાસ્તદ્વ વાક્યં

VIII યુષ્માન્ આદિષ્વાન્ સ એવાસ્માન્ આત્મના જનિતં યુષ્માંક પ્રેમ જાપિતવાન્।

IX વયં યદ્ દિનમ્ આરભ્ય તાં વાર્તાં શ્રુતવન્તસ્તદારભ્ય નિરન્તરં યુષ્માંક કૃતે પ્રાર્થનાં કુર્મઃ: ફલતો યૂયં યત્ પૂર્ણાભ્યામ્ આન્તિકજ્ઞાનવુદ્ધિત્યામ્ ઈશ્વરસ્યાલિતમં સમ્પૂર્ણરૂપેણાવગાચ્છેત,

X પ્રભો યોગ્યં સર્વથા સન્તોષજનકઅચાચારં કુર્ચ્છાર્તાર્થત ઈશ્વરજ્ઞાને વર્જ્ઞમાનાઃ સર્વસત્કર્મરૂપં ફલં ફલેત,

XI યથા ચેશ્વરસ્ય મહિમયુક્તયા શક્તયા સાનન્દેન પૂર્ણો સહિષ્ણુતાં તિતિક્ષાઅચાચારિતું શક્યથ તાદૃશેન પૂર્ણબલેન યદ્ બલવન્તો ભવેત,

**XII** यश्च पिता तेजोवासिनां पवित्रलोकानाम्  
अधिकारस्यांशित्वायास्मान् योग्यान् कृतवान् तं यद् धन्यं वदेत  
वरम् अेनं याचामङ्गे

**XIII** यतः सोऽस्मान् तिभिरस्य कर्तृत्वाद् उद्घृत्य स्वकीयस्य  
प्रियपुत्रस्य राज्ये स्थापितवान्

**XIV** तस्मात् पुत्राद् वयं परित्राणम् अर्थतः पापमोचनं प्राप्तवन्तः।

**XV** स यादृश्यस्येश्वरस्य प्रतिमूर्तिः कृत्स्नायाः सृष्टेरादिकर्ता च।

**XVI** यतः सर्वमेव तेन ससृजे सिंहासनराजत्वपराक्षमादीनि  
स्वर्गमत्त्यस्थितानि दृश्यादृश्यानि वस्तुनि सर्वाणि तेनैव तस्मै च  
ससृजिरे।

**XVII** स सर्वेषाम् आदिः सर्वेषां स्थितिकारकश्च।

**XVIII** स एव समितिरूपायास्तनो मूर्धा किञ्च सर्वविषये स यद्  
अग्रियो भवेत् तदर्थं स एव मृतानां मध्यात् प्रथमत उत्थितोऽग्रश्च।

**XIX** यत ईश्वरस्य कृत्स्नं पूर्णात्वं तमेवावासयितुं

**XX** कुशो पातितेन तस्य रक्तेन सन्धिं विधाय तेनैव स्वर्गमत्त्यस्थितानि  
सर्वाणि स्वेन सह सन्धापयितुञ्चरेणाभिलेषो।

**XXI** पूर्वं दूरस्था दुष्क्षियारतमनस्कत्वात् तस्य रिपवश्चास्त ये यूयं  
तान् युष्मान् अपि स इदानीं तस्य मांसलशरीरे मरणेन स्वेन सह  
सन्धापितवान्।

**XXII** यतः स स्वसम्मुखे पवित्रान् निष्कलङ्घान् अनिन्दनीयांश्च युष्मान्  
स्थापयितुम् इच्छिति।

**XXIII** किन्त्वेतदर्थं युष्माभि र्बद्धमूलैः सुस्थिरैश्च भवितव्यम्,  
आकाशमण्डलस्याधःस्थितानां सर्वलोकानां मध्ये च धुष्यमाणां यः  
सुसंवादो युष्माभिरश्चावि तज्ज्ञातायां प्रत्याशायां युष्माभिरथलै  
भवितव्यं।

**XXIV** तस्य सुसंवादस्यैकः परिचारको योऽहं पौलः सोऽहम्  
इदानीम् आनन्देन युष्मदर्थं हुःभानि सह ख्रीष्णस्य क्लेशभोगस्य  
र्योशोऽपूर्णस्तमेव तस्य तनोः समितेः कृते स्वशरीरे पूरयामि च।

**XXV** યત્ ઈશ્વરસ્ય મન્ત્રણાયા યુષ્મદર્થમ્ ઈશ્વરીયવાક્યસ્ય પ્રચારસ્ય  
ભારો મધ્ય સમપિતસ્તસ્માદ્ અહું તસ્યાઃ સમિતે: પરિચારકોડભવાં

**XXVI** તત્ નિગૂઢું વાક્યં પૂર્વયુગેષુ પૂર્વપુરુષેભ્યઃ પ્રચછન્મ આસીત્  
કિન્તિવદાનીં તસ્ય પવિત્રલોકાનાં સંનિધૌ તેન પ્રાકાશ્યતા

**XXVII** યતો ભિન્નજાતીયાનાં મધ્યે તત્ નિગૂઢવાક્યં  
કીદૃગ્ગૌરવનિધિસમ્બલિતં તત્ પવિત્રલોકાનું જાપયિતુમ્  
ઈશ્વરોડભ્યલષ્ટત્ય યુષ્મન્મધ્યવર્તી ખ્રીષ્ટ એવ સ નિધિ ગૈરવાશાભૂમિશ્યા

**XXVIII** તસ્માદ્ વચ્ચે તમેવ ઘોષયન્તો યદૃ એકૈકં માનવં સિદ્ધીભૂતં  
ખ્રીષ્ટે સ્થાપયેમ તદર્થમેકૈકં માનવં પ્રબોધયામઃ પૂર્ણજ્ઞાનેન ચૈકૈકં માનવં  
ઉપદિશામઃ।

**XXIX** એતદર્થે તસ્ય યા શક્તિઃ પ્રબલરૂપેણ મમ મધ્યે પ્રકાશતે તયાહું  
યતમાનઃ શ્રાભ્યામિ

## II

**I** યુષ્માકું લાયદિકેયાસ્થભાતૃણાં કૃતે યાવન્તો ભ્રાતરશ્ચ મમ  
શારીરિકમુખં ન દૃષ્ટવન્તસ્તેષાં કૃતે મમ કિયાન્ યત્નો ભવતિ તદૃ યુષ્માન્  
જાપયિતુમ્ ઈચ્છામિ।

**II** ફલતઃ પૂર્ણબુદ્ધિરૂપધનભોગાય પ્રેમના સંયુક્તાનાં તેષાં મનાંસિ  
યત્ પિતુરીશ્વરસ્ય ખ્રીષ્ટસ્ય ચ નિગૂઢવાક્યસ્ય જ્ઞાનાર્થ સાન્ત્વનાં  
પ્રાન્યુરિત્યર્થમહું યતો

**III** યતો વિદ્યાજ્ઞાનયો: સર્વે નિધય: ખ્રીષ્ટે ગુપ્તાઃ સન્તિઃ

**IV** કોડપિ યુષ્માન્ વિનયવાક્યેન યત્ત વન્નયેત્તુ તદર્થમ્ એતાનિ મયા  
કથ્યન્તો

**V** યુષ્મત્સનિધૌ મમ શરીરેડવર્તમાનેડપિ મમાત્મા વર્તતે તેન યુષ્માકું  
સુરીતિં ખ્રીષ્ટવિશ્વાસે સ્થિરત્વાં દૃષ્ટવાહમ્ આનન્દામિ।

**VI** અતો યૂચં પ્રભું યીશુખ્રીષ્ટં યાદૃગ્ ગૃહીતવન્તસ્તાદૃક્ તમ્ અનુયરતા

**VII** તસ્મિન્ બદ્ધમૂલાઃ સ્થાપિતાશ્ચ ભવત યા ચ શિક્ષા યુષ્માભિ  
ર્લબ્ધા તદનુસારાદ્ વિશ્વાસે સુસ્થિરાઃ સન્તસ્તેનૈવ નિત્યં ધન્યવાં કુરુતા

**VIII** सावधाना भवत मानुषिकशिक्षात् ईहलोकस्य वर्णमालातश्चोत्पन्ना ख्रीष्टस्य विपक्षा या दर्शनविद्या भिथ्याप्रतारणा य तया कोडपि युष्माकं क्षतिं न जनयतु।

**IX** यत ईश्वरस्य कृत्स्ना पूर्णता मूर्तिमती ख्रीष्टे वसति।

**X** यूथञ्च तेन पूर्णा भवथ यतः स सर्वेषां राजत्वकर्तृत्वपदानां मूर्ध्दस्ति,

**XI** तेन य यूथम् अहस्तकृतत्वकछेदेनार्थतो येन शारीरपापानां विग्रसत्यज्यते तेन ख्रीष्टस्य त्वकछेदेन छिन्नत्वयो जाता।

**XII** मज्जने य तेन सार्द्धं श्मशानं प्राप्ताः पुन मृतानां मध्यात् तस्योत्थापयितुरीश्वरस्य शक्तेः फलं यो विश्वासस्तद्वारा तस्मिन्नेव मज्जने तेन सार्द्धम् उत्थापिता अभवता।

**XIII** स य युष्मान् अपराधैः शारीरिकात्वकछेदेन य मृतान् दृष्ट्वा तेन सार्द्धं ज्ञवितवान् युष्माकं सर्वान् अपराधान् क्षमितवान्।

**XIV** यच्च दण्डाङ्गारुपं ऋणपत्रम् अस्माकं विरुद्धम् आसीत् तत् प्रमाणिर्जितवान् शलाकाभिः कुशे बद्ध्वा दूरीकृतवांश्च।

**XV** किञ्च तेन राजत्वकर्तृत्वपदानि निस्तेजांसि कृत्वा पराजितान् रिपूनिव प्रगल्भतया सर्वेषां दृष्टिगोचरे हेपितवान्।

**XVI** अतो हेतोः खाद्याभाद्ये पेचापेचे उत्सवः प्रतिपद् विश्रामवारश्वैतेषु सर्वेषु युष्माकं न्यायाधिपतिरूपं कमपि मा गृह्णीता।

**XVII** यत एतानि छायास्वरूपाणि किन्तु सत्या मूर्तिः ख्रीष्टः।

**XVIII** अपरञ्च नम्रता स्वर्गदूतानां सेवा यैतादृशम् ईष्टकर्माचरन् यः कश्चित् परोक्षविषयान् प्रविशति स्वकीयशारीरिकभावेन य मुघा गर्वितः सन्।

**XIX** सन्धिभिः शिराभिश्चोपकृतं संयुक्तञ्च कृत्स्नं शरीरं यस्मात् मूर्धत ईश्वरीयवृद्धिं प्राज्ञोति तं मूर्धनं न धारयति तेन मानवेन युष्मतः फलापहरणं नानुज्ञानीता।

**XX** यदि यूथं ख्रीष्टेन सार्द्धं संसारस्य वर्णमालायै मृता अभवत तर्हि यै द्रव्यै र्भोगेन क्षयं गन्तव्यं।

**XXI** तानि मा स्पृश मा भुंक्ष्व मा गृहाणेति मानवैरादिष्टान् शिक्षितांश्च विधीन्

**XXII** आचरन्तो यूयं कुतः संसारे ज्ञवन्त ईव भवथ?

**XXIII** ते विधयः स्वेष्टाभक्त्या नम्रतया शरीरकलेशनेन् च ज्ञानविधिवत् प्रकाशन्ते तथापि तडगाण्याः शारीरकभाववद्धकाश्च सन्ति।

### III

**I** यदि यूयं ख्रीष्णेन सार्द्धम् उत्थापिता अभवत तर्हि यस्मिन् स्थाने ख्रीष्ट ईश्वरस्य दक्षिणपार्श्वे उपविष्ट आस्ते तस्योद्धधस्थानस्य विषयान् येष्टध्वं।

**II** पार्थिवविषयेषु न यतमाना उद्धधस्थविषयेषु यतध्वं।

**III** यतो यूयं मृतवन्तो युज्माकं ज्ञवितञ्च ख्रीष्णेन सार्द्धम् ईश्वरे गुप्तम् अस्ति।

**IV** अस्माकं ज्ञवनस्वरूपः ख्रीष्टो यदा प्रकाशिष्यते तदा तेन सार्द्धं यूयमपि विभवेन प्रकाशिष्यध्वं।

**V** अतो वेश्यागमनम् अशुचिक्षिया रागः कुत्सिताभिलाखो देवपूजातुत्व्यो लोभश्वैतानि पाँचांथवपुरुषस्याङ्गानि युज्माभिर्निहन्यन्तां।

**VI** यत एतेभ्यः कर्मभ्य आजालङ्घनो लोकान् प्रतीश्वरस्य कोधो वर्तते।

**VII** पूर्वं यदा यूयं तान्युपाज्ञवत तदा यूयमपि तान्येवाचरत;

**VIII** किन्त्विदानीं कोधो रोषो जिह्विसिषा दुर्मुखता वदननिर्गतिकदालपश्वैतानि सवर्णिणि दूरीकुरुध्वं।

**IX** यूयं परस्परं मृषाकथां न वदत यतो यूयं स्वकर्मसहितं पुरातनपुरुषं त्यक्तवन्तः।

**X** स्वस्त्रः प्रतिमूर्त्या तत्वज्ञानाय नूतनीकृतं नवीनपुरुषं परिहितवन्तश्च।

**XI** તેન ચ ચિહ્નદિભિત્રજાતીયચોશિજ્ઞત્વગચ્છિજ્ઞત્વચો મર્લેચ્છસ્કુથીયચો દર્સમુકતયોશ્વ કોડપિ વિશેષો નાસ્તિ કિન્તુ સર્વેષુ સર્વઃ ખ્રીષ્ટ એવાસ્તો

**XII** અતએવ યૂયમ્ ઈશ્વરસ્ય મનોભિલબિતાઃ પવિત્રાઃ પ્રિયાશ્વ લોકા ઇવ સ્નેહયુક્તામ્ અનુક્રમાં હિતૈબિતાં નમ્રતાં તિતિક્ષાં સહિષ્ણુતાશ્વ પરિધદ્ધાં

**XIII** યૂયમ્ એકૈકસ્યાચરણાં સહધં ચેન ચ યસ્ય કિમાચ્યપરાધ્યતે તસ્ય તં દોષં સ ક્ષમતાં, ખ્રીષ્ટો યુષ્માં દોષાન્ યદ્દ્વદ્ ક્ષમિતવાન્ યૂયમપિ તદ્ગત્ કુરુધં

**XIV** વિશેષતઃ સિદ્ધિજનકેન પ્રેમબન્ધનેન બદ્ધા ભવતા

**XV** યસ્યાઃ પ્રાતએ યૂયમ્ એકસ્મિન્ શરીરે સમાજૂતા અભવત સેશ્વરીયા શાન્તિ યુષ્માં મનાંસ્યધિતિષ્ઠતુ યૂયશ્વ ફૃતશા ભવતા

**XVI** ખ્રીષ્ટસ્ય વાક્યાં સર્વવિધજ્ઞાનાય સમ્ભૂર્ણરૂપેણ યુષ્મદન્તરે નિવમતુ, યૂયશ્વ ગીતૈ ગાનૈ: પારમાર્થિકસઙ્કીર્તનેશ્વ પરસ્પરમ્ આદિશત પ્રબોધયત ચ, અનુગૃહીતત્વાત્ પ્રભુમ્ ઉદ્દિશ્ય સ્વમનોલિ ગર્યિત ચા

**XVII** વાચા કર્મણા વા યદ્ યત્ કુરુત તત્ સર્વ પ્રભો રીશો નર્મના કુરુત તેન પિતરમ્ ઈશ્વરં ધન્યં વદત ચા

**XVIII** હે યોષિતઃ, યૂયં સ્વામિનાં વશ્યા ભવત યતસ્તદેવ પ્રભવે રોચતો

**XIX** હે સ્વામિનઃ, યૂયં ભાર્યાસુ પ્રીયધં તાઃ પ્રતિ પરણાલાપં મા કુરુધં

**XX** હે બાલાઃ, યૂયં સર્વવિષયે પિત્રોરાજાગ્રાહિણો ભવત યતસ્તદેવ પ્રભો: સન્તોષજનકાં

**XXI** હે પિતરઃ, યુષ્માં સન્તાના યત્ કાતરા ન ભવેયુસ્તદર્થ તાન્ પ્રતિ મા રોષ્યતા

**XXII** હે દાસાઃ, યૂયં સર્વવિષય ઔહિકપ્રભૂનામ્ આજાગ્રાહિણો ભવત દૃષ્ટિગોચરીયસેવયા માનવેભ્યો રોચિતું મા યતધં કિન્તુ સરલાન્તઃકરણૈ: પ્રભો ર્ભાગીત્યા કર્ાર્ય કુરુધં

**XXIII** યચ્ચ કુરુધ્વે તત્ માનુષમનુદ્દિશ્ય પ્રભુમ્ ઉદ્દિશ્ય પ્રકુલ્લમનસા કુરુધં,

**XXIV** યતો વયં પ્રભુતઃ સ્વર્ગાધિકારરૂપં ફલં લપ્સ્યામહ ઇતિ યૂયં  
જાનીથ યસ્માદ્ યૂયં પ્રભો: ખ્રીષ્ટસ્ય દાસા ભવથા

**XXV** કિન્તુ ય: કશ્ચિદ અનુચિતં કર્મ કરોતિ સ તસ્યાનુચિતકર્મણઃ:  
ફલં લપ્સ્યતે તત્ત્ર કોડપિ પક્ષપાતો ન ભવિષ્યતિ

## IV

**I** અપરઞ્ચ હે અધિપતયઃ, યૂયં દાસાન્ પ્રતિ ન્યાયં યથાર્થાચારણાં  
કુરુધ્વં યુષ્માકમાયેકોડધિપતિઃ સ્વર્ગો વિદ્યત ઇતિ જાનીતા

**II** યૂયં પ્રાર્થનાયાં નિત્યં પ્રવર્તાધ્વં ધન્યવાદું કુર્વન્તસતત્ત્ર પ્રબુદ્ધાસ્તિષ્ઠત  
ચા

**III** પ્રાર્થનાકાલે મમાપિ કૃતે પ્રાર્થનાં કુરુધ્વં,

**IV** ફલતઃ ખ્રીષ્ટસ્ય યન્ત્રિગ્રહવાક્યકારણાદ્ અહં બદ્ધોડભવં  
તત્પકાશાયેશ્વરો યત્ત મદ્દ્ય વાગ્દારં કુર્ચિતિ, અહઞ્ચ યથોચિતં તત્ત  
પ્રકાશયિતું શક્નુયામ્ એતત્ત્ર પ્રાર્થયધ્વં

**V** યૂયં સમયં બહુમૂલ્યં જાત્વા બહિઃસ્થાન્ લોકાન્ પ્રતિ જ્ઞાનાચારં  
કુરુધ્વં

**VI** યુષ્માકમ્ આલાપ: સર્વદાનુગ્રહસૂચકો લવણેન સુસ્વાદુશ્ચ ભવતુ  
યસ્મૈ યદૃતરં દાતવ્યં તદ્દ યુષ્માભિરવગમ્યતાં

**VII** મમ યા દશાક્તિ તાં તુભિકનામા પ્રભૌ પ્રિયો મમ ભ્રાતા  
વિશ્વસનીય: પરિચારક: સહદાસશ્ચ યુષ્માન્ જ્ઞાપયિષ્યતિ

**VIII** સ યદ્દ યુષ્માકં દશાં જાનીયાત્ત યુષ્માકં મનાંસિ સાન્ત્વયેચ્ય  
તદ્ધર્મેવાહું

**IX** તમ્ ઓનીષિમનામાનઞ્ચ યુષ્મદેશીયં વિશ્વસ્તં પ્રિયઞ્ચ ભ્રાતરં  
પ્રેષિતવાન્ તૌ યુષ્માન્ અત્રત્યાં સર્વવાર્તાં જ્ઞાપયિષ્યતઃ।

**X** આરિષાર્થનામા મમ સહબન્દી બર્ણાયા ભાગિનેયો માર્કો  
યુષ્મનામના વિષ્યાતો યીશુશ્રેષ્ઠે છિન્તત્વચો ભ્રાતરો યુષ્માન્ નમસ્કારં  
જ્ઞાપયન્તિ, તેણાં મધ્યે માર્કમધિ યૂયં પૂર્વમ્ આજ્ઞાપિતાઃ સ યદિ  
યુષ્મત્સમીપમ્ ઉપતિષ્ઠત્ત તર્હિ યુષ્માભિ ગૃહ્યતાં

**XI** કેવલમેત ઈશ્વરરાજ્યે મમ સાન્ત્વનાજનકાઃ સહકારિણોડભવન્

**XII** ખ્રીષ્ટસ્ય દાસો ચો યુષ્મદેશીય ઈપફાઃ સ યુષ્માન્ નમસ્કારં  
જાપ્યતિ યૂધશ્વરસ્ય સર્વસ્મિન્ મનોડભિલાષે યત્ત સિદ્ધાઃ પૂર્ણાંજ્ય  
ભવેત તદર્થ્ય સ નિત્યં પ્રાર્થનયા યુષ્માંક કૃતે યતતો

**XIII** યુષ્માંક લાયદિકેયાસ્થિતાનાં હિયરાપલિસ્થિતાનાંજ્ય ભાતૃણાં  
હિતાય સૌડતીવ ચેષ્ટત ઈત્યસ્મિન્ અહ્ં તરસ્ય સાક્ષી ભવામિ

**XIV** લૂકનામા પ્રિયશ્રીકિત્સકો દીમાંજ્ય યુષ્મબ્યં નમસ્કુલ્યતો

**XV** યૂયં લાયદિકેયાસ્થાન્ ભાતૃન્ નુમ્ફાં તદ્ગુહસ્થિતાં સમિતિઅં મમ  
નમસ્કારં જાપ્યતા

**XVI** અપરે યુષ્મત્સન્નિધૌ પત્રસ્યાસ્ય પાઠે કૃતે  
લાયદિકેયાસ્થસમિતાવપિ તરસ્ય પાઠો યથા ભવેત્ લાયદિકેયાઅં  
યત્ત પત્રં મયા ગ્રહિતં તદ્ય યથા યુષ્માભિરપિ પછેત તથા ચેષ્ટધ્વાં

**XVII** અપરમ્ આર્જિયં વદત પ્રભો ર્થત્ પરિચય્યપદ્ ત્વયાપ્રાપિ  
તત્સાધનાય સાવધાનો ભવા

**XVIII** અહ્ં પૌલઃ સ્વહસ્તાક્ષરેણ યુષ્માન્ નમસ્કારં જાપ્યામિ યૂયં મમ  
બન્ધનં સ્મરતા યુષ્માન્ પ્રત્યનુગ્રહો ભૂયાત્તુ આમેના

## **Sanskrit Bible (NT) in Gujarati Script New Testament in Sanskrit Language; printed in Gujarati Script**

copyright © 2018 SanskritBible.in

Language: Sanskrit

Contributor: SanskritBible.in

Thank you for your interest in Sanskrit Bible.

Sanskrit Bible (NT) is freely available in 22 different scripts of your choice. This edition is in Gujarati script and is based on the Sanskrit translation of the Holy Bible published by Calcutta Baptist Missionaries in 1851. Please visit SanskritBible.in to learn more about Sanskrit Bible and to download various free Christian literature.

This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0.

You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:

You include the above copyright and source information.

If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.

If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.

Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners.

Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.

2020-01-01

---

PDF generated using Haiola and XeLaTeX on 11 Nov 2022 from source files  
dated 29 Jan 2022

e1290797-4477-53f0-873d-c9153a72fd01